

મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., ગોધરા દ્વારા મકાઈ પાકમાં જૈવિક ખાતરનું મહત્વ અને મકાઈની વૈજ્ઞાનિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ.

પંચમહાલ જીલ્લાના મુખ્ય પાક એવા મકાઈપાકના વધુ ઉત્પાદન માટે મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., ગોધરા દ્વારા તા.૧૬/૧૦/૨૦૧૭ ના રોજ “મકાઈ પાકમાં જૈવિક ખાતરનું મહત્વ અને મકાઈની વૈજ્ઞાનિક ખેતી” અંગે ખેડૂત તાલીમ અત્રેના કેન્દ્ર ખાતે કરેલ હતી.

ખેડૂતોને મકાઈની આધુનિક તાંત્રિકતાઓથી વાકેફ કરવા એ ખુબ જ અગત્યનું હોઈ આ અંગેની તાલીમ આપવા માટે તેમજ પ્રથમ હરોળના નિદર્શન માટે બાયોફર્ટીલાઈઝર યોજના હેઠળ અત્રેના કેન્દ્ર ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૧૦૦ જેટલા ખેડૂતમિત્રોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. પ્રો.ડી.એમ.રાઠોડ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (વિસ્તરણ) દ્વારા મકાઈ પાકમાં જૈવિક ખાતરનું મહત્વ તથા બાયોફર્ટીલાઈઝરનો ઉપયોગ કરી રસાયણિક ખાતરનો વપરાશ ઓછો કરીને ખેતી ખર્ચ ઘટાડવા માટે અનુરોધ કર્યો હતો. આ તાલીમ કાર્યક્રમમાં કેન્દ્રના યુનિટ હેડ અને સહસંશોધન વૈજ્ઞાનિક ડૉ.એમ.બી.પટેલ એ મકાઈની મુલ્ય વર્ધિત તથા સંયોજિત અને સંકર જાતોની માહિતી આપી. ડૉ.પી.કે.પરમાર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (પ્લાન્ટ બ્રીડીંગ) એ મકાઈ પાકમાં બીજ વૃદ્ધિ કાર્યક્રમની માહિતી આપેલ હતી.

પ્રો.કે.એચ.પટેલે, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એગ્રો) દ્વારા મકાઈની નફાકારક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગેના ચાવીરૂપ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી. ડૉ.એસ.કે.સીંઘ,મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (પેથો) દ્વારા મકાઈમાં આવતા રોગો અને જીવાતનું નિયંત્રણ અંગે વિગતવાર માહિતી આપેલ હતી તેમજ ડૉ.બી.એન.ઠક્કર,મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (વિસ્તરણ) દ્વારા મકાઈમાં ક્ષેત્રીય નિદર્શનથી થતા ફાયદાઓ વિષે વિસ્તૃતમાં માહિતી આપી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.કે.એચ.પટેલ અને પ્રો.ડી.એમ.રાઠોડે કરેલ હતું.કાર્યક્રમની અંતે ખેડૂતભાઈઓને પ્રથમ હરોળના નિદર્શનો માટે મકાઈની હાઈબ્રીડ જાત(જી.એ.વાય.એમ.એચ.-૧), એટ્રાજીન નામની નીંદણ નાશક દવા તથા ફ્યુરાડાન નામની જંતુનાશક દવાનું વિતરણ કરવામાં આવેલ હતું.

